

શ્રી અનંતનાથાય નમઃ

તા.૨૪/૦૭/૨૦૨૨

જય જિનેન્દ્ર, સર્વે સભ્યો કુશળ મંગલ હશે,

આપ સર્વે મહાસમિતિ ના સભ્યોને જણાવવાનું કે તા.૨૨/૦૫/૨૦૨૨ના મુંબઈ ખાતે મહાસમિતિની પ્રથમ સભામાં સેક્રેટરી જનરલ શ્રી નિશીથભાઈ દંડ દ્વારા વિવિધ સમિતિઓના કાર્યોની રૂપરેખા અને તેના દ્વારા થઈ રહેલી દેશભરના જ્ઞાતિજનોની ખરી મદદ ની જાણ ઉપસ્થિત સભ્યોને જણાવી હતી.

સભામાં શ્રી નિશીથભાઈ દંડ દ્વારા અન્ય સમિતિના સભ્યોને આગામી વર્ષોમાં જ્ઞાતિજનોને મદદરૂપ થઈ શકાય તેવા પ્રકલ્પો પર કામ કરવા અપીલ કરી હતી, જેના સ્વરૂપે અને તેમની પ્રેરણાથી સ્વાભિમાન સમિતિના ચેરમેન શ્રીમતી હેમાબેન ગુલાબ છેડા, કન્વીનર અને ટ્રસ્ટીશ્રી હંસ બી. ખીમજી, સભ્યો શ્રી રાયચંદ ડી. જીવાણી, શ્રી તેજપાલ એલ. ધરમશી શ્રી પદમકુમાર ડી. નાગડા, શ્રી સુજીવ જે. સોની, શ્રી દિલીપ આર. નાગડા, શ્રી કિશોર ટી. રતાણી, શ્રી પ્રદીપ એ. ખોના, શ્રી વીરચંદ એન. લોડાયા, તથા શ્રીમતી અમિષા આર. મુનવર., દરેક સભ્યોની સુઝબુઝથી સરાહનીય એવી **સિનિયર સિટીજન (વરિષ્ઠ) માટે "ધન્વંતરિ"** નામની યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના માટે ટૂંક સમયમાં સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પગલે ડોનેશન જમા કરીને જ્ઞાતિના વરિષ્ઠ જેમની વય દુપ વર્ષ થી ઉપર અને પરિવારની રૂ. ૧૫૦૦૦/- સુધીની આવક ધરાવનારને તેમની દવા માટેની આર્થિક સહાય રૂ.૧૦૦૦/- પેન્શન રૂપે પ્રતિ માહ એક વર્ષ સુધી હાલ પૂરતી આપવામાં આવશે, વધુમાં વરિષ્ઠ વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે વોકસ્ટિક, વોકર અને કમર પટ્ટો જેવી સહાયક વસ્તુ પણ આપવામાં આવશે જેની નોંધ લેશોજી.

જેમ જેમ આ " ધન્વંતરિ " યોજનામાં આપણા જ્ઞાતિજનોનો તથા દરેક મહાજનો નો આર્થિક સહયોગમાં વધારો થતો રહેશે તેમ તેમ આપણે આ યોજનાને વધુ સમય માટે આપવાનો પ્રયત્ન કરતા રહેશું.

આ સાથે આ યોજના નું ફોર્મ અને ગુગલ ફોર્મ ની વિગત મોકલેલ છે , જરૂરિયાતમંદ વ્યક્તિને મોકલી અથવા જાણ કરીને મદદરૂપ થવા વિનંતી છે, જે દરેક મહાસમિતિના સભ્યની ફરજ પણ છે તથા જે તે મહાજન ના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા છો તે મહાજનના પદાધિકારીઓને જાણ કરવાની જવાબદારી પૂર્ણપણે નિભાવવા વિનંતી છે., આ યોજનામાં અરજી કરનારે ફોર્મ ભરીને નીચે જણાવેલ સભ્યોમાંથી કોઈ એક ને વોટ્સએપ દ્વારા મોકલવા વિનંતી છે ,અન્ય કોઈ પણ બાબતની વિગત અથવા જાણકારી માટે સ્વાભિમાન સમિતિના સભ્યોનો સંપર્ક કરવા વિનંતી છે.

**શ્રીમતી હેમાબેન જી. છેડા - ૯૮૪૪૦૪૪૪૨૮ .**

**શ્રી રાયચંદ જીવાણી - ૯૭૭૯૯૭૫૧૦૯ .**

**શ્રી તેજપાલ એલ. ધરમશી - ૯૮૭૦૦૭૦૦૨૭.**

**લી. સ્વાભિમાન સમિતિ**

**શ્રી સમસ્ત કચ્છી દશા ઓસવાલ જૈન મહાજન.**